

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, જામનગર

લોક દરબાર તારીખ : ૦૮.૦૪.૨૦૧૬ શુક્રવાર	સ્થળ : ઉમેદભવન, નગર પાલિકા, કન્યા વિદ્યાલય, મુ.જામજોધપુર	સમય : ૧૫:૩૦ કલાકે	તાલુકો : જામજોધપુર
---------------------------------------	-------------------------------------------------------------	-------------------	--------------------

તા.૦૮.૦૪.૨૦૧૬ ના રોજ કાલાવડ મૂકામે સરકારશ્રી દ્વારા માનનિય કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાની હાજરીમાં યોજનારા “લોક સંવાદ સેતુ - લોક દરબાર” અંતર્ગત રજુ થયેલ પ્રશ્ન/રજુઆતની વિગતો:

ક્રમ	પ્રશ્ન નંબર	અરજદારશ્રી નું નામ	પ્રશ્નની ટુંકી વિગત	અમલીકરણ અધિકારી / ખાતાના વડાશ્રીનો પ્રશ્ન નિકાલ અંગેનો જવાબ	રીમાર્ક્સ
૦૧	૨૩	સરપંચશ્રી, ભરડકી ગ્રામ પંચાયત.	(૧) ગ્રામ પંચાયત પાણી પુરવઠા અંતર્ગત કુવામાં થી-ફેઇઝ કનેક્શન મળવા અંગે. (૨) ભરડકી ગામે ગામતળ વિસ્તારમાં પીજીવીસીએલ તરફથી ઘરવપરાશના વીજકનેક્શન જોડાણ ન આપવા અંગે.	(૧) સરપંચશ્રી, ભરડકી ગ્રામ પંચાયત દ્વારા હયાત સિંગલ ફેઇઝ પાણી પુરવઠાના વીજ જોડાણને ૧૦ હોર્સ પાવરના થી ફેઇઝ વીજ જોડાણમાં ફેરવવા માટે તા.૦૧.૦૩.૨૦૧૬ના અરજી કરેલ. જે અનુસંધાને તા.૦૩.૦૩.૨૦૧૬ના રોજ અંદાજપત્ર નં.૯૨૫ થી રૂ.૧૦,૫૨૩/-નું ગ્રામ પંચાયત, ભરડકીને પાઠવવામાં આવેલ છે તથા સરપંચશ્રીને આ બાબતે જાણ કરેલ. પરંતુ સદર અંદાજપત્રની રકમ ભરપાઈ કરેલ નથી. સદર અંદાજપત્રની રકમ ભરપાઈ થયે તાત્કાલિક અગ્રતાના ધોરણે વીજજોડાણ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. (૨) ભરડકી ગામે સવાલવાળા વીજજોડાણ અંગે ભરડકી ગામના સરપંચશ્રીની હાજરીમાં તા.૦૪.૦૪.૨૦૧૬ના રૂબરૂ સ્થળ તપાસ કરતા જાણવામાં આવેલ કે સદર જમીન સીમતળમાં આવેલ છે. સદર વિસ્તારમાં કંપનીના પ્રવર્તમાન નિયમાનુસાર ખેતીવાડી વિસ્તારમાં ખેતીવાડી ફીડરમાંથી ઘરવપરાશ હેતુનાં વિજજોડાણો આપવામાં આવે છે. આ ખેતીવાડી ફીડરોમાં દિવસમાં આઠ કલાક થી ફેઝ અને બાકીના સમય	નિકાલ

				દરમ્યાન સિંગલફેઝ વિજપુરવહો કે જેનો ધરવપરાશમાં ઉપયોગ થઈ શકે તે હેતુથી આપવામાં આવે છે.	
૦૨	૨૯	ફિરોઝ મામદભાઈ મલેક, ગામ - પરડવા.	પરડવા ગામે રોડ ઉપર અનેક જગ્યાએ પીજીવીસીએલનાં વીજ વાયરો કોસ થાય છે. તેથી આવા કોસિંગ શક્ય તેટલા દુર કરવા. તથા કોસિંગની જગ્યા એ એ.એફ.સી. કેબલ વાપરવો.	પરડવા ગામે રહેલ ૬૬ કેવી સબસ્ટેશનમાથી નીકળતા તમામ ફીડરોમાં ૬૬ કેવી સબસ્ટેશન પાસે થતાં કોસિંગમાં AB કેબલ નાખેલ છે તથા રોડ કોસિંગમાં નિયમ મુજબની યોગ્ય ઊંચાઈ જાળવી રોડ કોસ કરેલ છે.	નિકાલ
૦૩	૧૧૬	સરપંચશ્રી, ચુર ગ્રામ પંચાયત.	ચુર ગામમાં રબારી વિસ્તારમાં નવા વિજજોડાણ માટે બે વિજપોલ ઉભા કરવા બાબત	સદર રજુઆતના અનુસંધાને ચુર ગામના રબારી વિસ્તારમાં સ્થળ સર્વે કરતાં નવા ધરમીટર માટેની કોઈ અરજી પડતર નથી. વધુમાં સદર વિસ્તારમાં નવા વિજજોડાણ માટેની અરજી કરવામાં આવશે તો અગ્રતાના ધોરણે જરૂર જણાયે નવા વિજપોલ ઉભા કરી વિજકનેક્શન આપવાની કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે. આ અંગે સરપંચશ્રીનો સંપર્ક કરેલ છે. આમ પ્રશ્નનું સુખદ નિરાકરણ કરેલ છે.	નિકાલ
૦૪	૧૨૧	રામભાઈ કાનાભાઈ ડાંગર, ગામ - આંબરડી મેઘપર	(૧) તા. ૧૬.૦૩.૨૦૧૬ના પીજીવીસીએલ દ્વારા આંબરડી મેઘપર ગામે ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં આપવામાં આવેલ ઇંડ ગેરવ્યાજબી હોવા બાબત. (૨) મારી માલિકીના પ્લોટમાંથી વીજ પોલ દુર કરવા બાબત.	(૧) અરજદાર ની મળેલ ફરીયાદના અનુસંધાને જણાવવાનું કે, તા ૧૬.૦૩.૨૦૧૬ ના રોજ પીજીવીસીએલ દ્વારા મેઘપર આંબરડી ગામે કોઈ વીજચેકિંગ હાથ ધરાયેલ નથી. સદર અરજદારને આપવામાં આવેલ વિજચોરીના બીલ બાબતે ઓફીસ રેકોર્ડ તપાસતા મેઘપર આંબરડી ગામે તા.૧૭.૦૨.૨૦૧૬ ના રોજ અરજદારશ્રીને ત્યાં થયેલ વીજચેકિંગ દરમ્યાન ચેકિંગસીટ નંબર SNCB ૨૪૪૬૨ મુજબ વિજચોરીનું બીલ વીજળી અધીનીયમ-૨૦૦૩ ની કલમ-૧૩૫ હેઠળ આપવામાં આવેલ છે. (૨) અરજદાર તરફથી મળેલ અરજીના અનુસંધાને તેમની માલિકીના પ્લોટમાં આવેલ વિજપોલને ફેરવવા માટેનું અંદાજપત્ર પત્ર નં.JJE/TECH/૧૨૮૮, તા.૦૪.૦૪.૨૦૧૬ ના રોજ આપેલ છે. અરજદાર	નિકાલ

				દ્વારા સદર રકમ ભરપાઈ કર્યા બાદ વિજપોલ ફેરવવાની કામગીરી પુર્ણ કરવામાં આવશે	
૦૫	૧૫૩	સામતભાઈ ટી. કરમુર, પ્રમુખશ્રી, જામજોધપુર તાલુકા કોંગ્રેસ. ગામ - રબારીકા	જામજોધપુર તાલુકામાં પીજીવીસીએલ દ્વારા ચોક્કસ ગામોમાં ચેકિંગ કરી અનાધિકૃત આકારણી બીલ આપવામાં આવે છે. તે રદ કરવા બાબત.	વિજ ચેકિંગની કાર્યવાહી વિજ ફિડરોના વિજલોસને ધ્યાનમાં રાખીને કાયદેસરના ગ્રાહકોને પુરતા દબાણથી અને સાતત્યપુર્વક વીજપુરવઠો મળી રહે તે હેતુ સબબ વીજ ચેકિંગની કાર્યવાહી નિયમાનુસાર કરવામાં આવે છે.	નિકાલ
૦૬	૧૫૫	સરપંચશ્રી, રબારીકા ગ્રામ પંચાયત.	પીજીવીસીએલ દ્વારા ચોક્કસ ગામોમાં ઈરાદાપૂર્વક ગેરકાયદેસર ચેકિંગ કરવા બાબત.	વિજ ચેકિંગની કાર્યવાહી વિજ ફિડરોના વિજલોસને ધ્યાનમાં રાખીને કાયદેસરના ગ્રાહકોને પુરતા દબાણથી અને સાતત્યપુર્વક વીજપુરવઠો મળી રહે તે હેતુ સબબ વીજ ચેકિંગની કાર્યવાહી નિયમાનુસાર કરવામાં આવે છે.	નિકાલ